

22nd & 23rd August, 2015



# Joy of Sharing 2015

श्रीमती એસ. આર. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના માનનીય રમેશદાદા વડે ઉમદા સમાજ ઉપયોગી લોકકલ્યાણના સેવાકીય કાર્યો થકી સમાજઉદ્ધાર તથા સમાજ સશક્તિકરણ કરવાના ભગીરથ ધ્યેય સાથે કરવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓનું, જ્યારે જ્યારે સમાજ ને વિકટ પરિસ્થિતિમાં મદદ કે સહકારની જરૂરિયાત ઉભી થઈ, ત્યારે ત્યારે ઉદાર હૃદયે પોતાનું યશસ્વી યોગદાન આપેલ છે. રમેશદાદાની આ સેવાકીય પ્રવૃત્તિઓ, તેઓ પોતાની સમાજપ્રત્યેની ઉમદા જવાબદારી તરીકે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સમાજના પ્રત્યેક પાસાને સ્પર્શતી સતરંગી પ્રવૃત્તિઓ જેવી કે— રમેશદાદાનું ભણતર – ઘડતર મિશન, બ્લડ ડોનેશન, થેલેસેમિયા ચકાસણી ટેસ્ટ, પૂર પીડિતો માટે રાહત સામગ્રીનું વિતરણ, જીવીબાનું રસોડું— ટીફીન વ્યવસ્થા અનેક શ્રેષ્ઠ અને ઉમદા શિક્ષણપૂરું પાડતા શૈક્ષણિક સંસ્થાઓની મદદ, સમાજ ઉપયોગી દાન, એન્જનીયરીંગ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષણ આપતી શ્રીમતી એસ.આર.પટેલ એન્જનીયરીંગ કોલેજ નું સફળ સંચાલન, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ તથા સ્કોલરશીપ, વગેરે જેવી અનેક હૃદયસ્પર્શી પ્રવૃત્તિઓ નિસ્વાર્થભાવે દશકોથી આ ટ્રસ્ટ વડે ચલાવવા માં આવે છે.

ટ્રસ્ટનો હેતુ જ “સર્વ જન સુખાય, સર્વ જન હિતાય” ની આધારશીલા પર રચાયેલો છે. હાલમાંજ બનાસકાંઠા જીલ્લામાં આવી પડેલ કુદરતી પૂરની વિપદામાં હજારો કુટુંબ ને ન પુરીશકાય તેવી માઠી અસરો થવા પામી હતી. અનેક લોકોએ પોતાની આજીવીકારરૂપી પશુસંપત્તિ, ઘર અને ખેતી, સ્વજનો ગુમાવ્યા. જાણે પૂરમાં સમગ્ર જીવનજરૂરિયાતનું બધુજ ડૂબી ગયું. બાળકો પોતાના પુસ્તકો, ભણવાની સામગ્રી પણ ગુમાવી બેઠા. ત્યારે આવા બાળકોના દુખદર્દ માં સહભાગી થવા તથા તેમને સ્કૂલમાં પાછા લાવવાના પ્રોત્સાહન હેતુસર, રમેશદાદા એ ૮૪ શાળાઓના અંદાજિત ૧૦,૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને પાંચ – પાંચ નોટબુક્સનો સેટ દાન કરી તેમના ભણતરને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્ન કરેલ છે.

Joy of Sharing ના ભાગરૂપે રમેશદાદાના આ સેવાના સ્વપ્નની પહેલ ને ચરિતાર્થ કરવા તેમના ચિ. શ્રી. કલ્પેશભાઈ ના સબળ નેતૃત્વ હેઠળ અને સંસ્થાના આચાર્ય શ્રીમતી અમીબેન ના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મઠ પ્રાધ્યાપાકોની વિવિધ ટીમો તા. ૨૨ અને ૨૩ ઓગષ્ટ, ૨૦૧૫ ના રોજ સમગ્ર બનાસકાંઠા જીલ્લાની વિવિધ અંતરિયાળ વિસ્તારની સ્કૂલોમાં ઘણા કપરા સંજોગો માં જીવન વ્યતિત કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતરની સામગ્રીરૂપી નોટ બુક વહેંચણી સેવાકાર્યનું સફળ આયોજન કરેલ હતું.

તન મન અને ધન ના ત્રિવેણી સંગમથી પ્રેરાયેલી આ સેવાપ્રવૃત્તિ, જરૂરિયાતમંદને નાનકડી મદદ કરવાના હેતુસર કરવામાં આવી હતી. સ્થળપર ની રૂબરૂ મુલાકાત હૃદય દ્રાવક હતી. કુદરતસામે લાચાર માનવીની અવસ્થા, ગરીબાઈ માં પુરની તારાજી નો મારો અસહ્ય હતો. પરંતુ હતાશાના વાતાવરણ માં પણ માનવતાના દર્શન સ્પષ્ટ જોઈ શકાતા હતા . ભલે પૈસે ગરીબ પ્રજા હોય પરંતુ આતિથ્ય સત્કારમાં અને માનવીય સંવેદના માં શહેરો કરતા ઘણા વિકસિત જોવા મળ્યા.

જ્યારે તેમણે તેમના બાળકો માટે ભણતરની આ અમૂલ્યભેટ સ્વીકારે ત્યારે તેમના અંતઃકરણના પ્રતિભાવો ભાવવિભોર કરનારા હતા.રમેશદાદાની આ મદદને તે સૌ ગ્રામજનોએ હૃદયપૂર્વક આવકારી અને તેઓનો કૃતજ્ઞભાવ આશીર્વાદ આપી વ્યક્ત કર્યો. એસ. આર. પટેલ કોલેજના પ્રાધ્યાપકો એ ગ્રામ જનોની સંવેદનાઓને કંઈક આ રીતે પોતાના શબ્દોમાં રજૂ કરી.

“કુદરત સામે માનવી કેટલો લાચાર છે અને તેની એક લપડાક માનવી નું અસ્તિત્વ શૂન્ય બનાવી દે છે. ઘણા બધા ગામમાં હજુ ૨૫ ફૂટ સુધી પાણી હતા અને સ્કૂલ કે ગામમા જવાની પરિસ્થિતિ ન હતી તેમના ઢોર ઢાંકર બધી જ જહોજહાપત, છોડી ખાલી પોતાનો જીવ બચાવી સુરક્ષિત જગ્યાએ પહોચી જવા મજબુર બન્યા .”હમ હે તો જહાં હૈ” તેમ સાર્થક થતા જોયું.ઘણી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવાની , ટોચલેટની કે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા ના હતી.” - ડૉ. અમીબેન શાહ

“ગરીબ બાળકોની ખુશી, ઉત્સાહ, લાગણીયો જે અનુભવી તે ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતી”.  
N. N. Chaudhari, Vinod P. Rajput, Amar Y Salariya & Ashvinbhai.

“આ મુશ્કેલભરી પરિસ્થિતીમાં તેમના માટે જે કઈપણ નાની સેવાકાર્યની તક મળી તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ” Nikunj M Patel, Jayendra B Patel, Shirin Patel, Adesh V. Panchal & Jignesh H Patel.

“નાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ના આ સેવાકાર્ય માં સહભાગી થવાની ઉમદાતક આપવા બદલ સંસ્થા તથા મેનેજમેન્ટ નો હૃદયપૂર્વક આભારવ્યક્ત કરીએ છીએ.” Manish D. Patel, Kaushik Patel, Chirag B Patel & Harshad A Patel.

“સાચી ખુશી કોને કહેવાય તે ત્યાંના બાળકોની મદદ કરીને મહેસુસ થયું. આવો અનુભવ જીંદગીમાં પ્રથમવાર થયો.” Snehal S Patel, Ajaypalsinh Barad & Vinod Rajput.

## Humble Request for Reform

વિવિધ અંતરિયાળ ગામની પરિસ્થિતિ ને રૂબરૂ નિહાળી અને ગ્રામજનોની સંવેદનાની વ્યથા સાંભળી ભવિષ્યમાં સમાજ તથા સરકાર સહભાગીથઈ સમાજઉપયોગી સશક્તિકરણ ના કાર્યો કરી શકાય છે.

- (1) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પીવાના સ્વચ્છ પાણી ની સગવડ.
- (2) પુરતી Sanitation Facility, Toilets પુરા પાડવા.
- (3) જરૂરિયાતમંદ શાળાના મકાનોની હાલત સુધારવી તે માટે ગ્રાન્ટ આપવી.
- (4) મદદ યોગ્ય વ્યક્તિ કે જરૂરિયાતમંદ સુધી પહોચાડવાની કાળજી લેવી.
- (5) અપૂરતા વર્ગખંડ, મકાનની તાત્કાલીક સગવડ કરવી. પોતાનું ન હોઈ તો સારા મકાન ભાડે રાખીને પણ સગવડ આપવી. શાળામાં પુરતું ફર્નીચર તથા આધુનિક સગવડ આપવી.
- (6) Transportation Facility.
- (7) Mid Day Meal Facility આપવી.
- (8) Health Check up Camp રાખવા.
- (9) ગામ અને શાળા સ્વચ્છતા અભિયાન કરવા.
- (10) પુરતી light ની વ્યવસ્થા કરવી.
- (11) ખૂટતા સ્ટાફની ભરતી કરવી અને શિક્ષણની કથળતી પરિસ્થિતિનું નિવારણ કરવું.
- (12) આર્થિક સહાય માટે સરકાર કે સમાજના યોગદાન ના કાર્યક્રમ યોજી પૂંજનો યોગ્ય સકારાત્મક ઉપયોગ કરવો.
- (13) ગામ જીવન ને ધબકતું રાખવાનો ભગીરથ પ્રયત્ન કરવો.
- (14) શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ને પ્રોત્સાહક સરકારી યોજનાઓ ઘડવી, અમલ કરવો.

## Principal & Faculties opinion



“ શિક્ષણ એજ જીવન “ ઉક્તિ ને ચરિતાર્થ કરતુ આ દ્રશ્ય ખરેખર શિક્ષણને ટકાવી રાખવા માટેની રાહત સામગ્રી નું વિતરણ કરતા સંસ્થાના આચાર્યા ડૉ. અમીબેન શાહ, પ્રા આદેશ વી.પંચાલ, પ્રા શીરીન પટેલ.

શાળામાં પહોંચી શકવાનું શક્ય ન હતું માટે , શાળાના સેવકભાઈ ના ઘરે વિતરણ કરતા પ્રા. મનીષભાઈ ડી પટેલ અને એકાઉન્ટર જીએશભાઈ પટેલ.



આ સેવાકાર્યથી મને સંતોષ અને હર્ષની લાગણી છે. આ ભાર નહિ પણ જવાબદારી નું પરિવહન છે. સંસ્થાના સિવિલ ડીપાર્ટમેન્ટના વડા પ્રા. અમર સલારીયા.




વિકટ પરિસ્થિતિ નો સામનો કરીને પણ ,ખુબ જ અંતરિયાળ શાળાનો સંપર્ક કરી સાચી સેવા અને મદદના દર્શન કરાવતા પ્રા. જે. બી. પટેલ અને પ્રા અજયભાઈ બારડ



## Sentiments of Humanity

મારા ઉજ્જવળભવિષ્યની આધારશીલા સમાન પુસ્તક અને નોટબુક સહાયથી પ્રસન્ન થરાદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.



વિતરણ સ્થળે આવેલી મદદમાં -મારા ભાગે શું? ની વ્યથામાં ચિંતાતુર શાળાના બાળકો

ભગવાન ભરોસે રહેલો માનવી અને આજનું શિક્ષણ પોતાના અસ્તિત્વ માટે મથી રહ્યું છે. સહકાર અને મદદની અપેક્ષા એ રાહ જોતી અવ્યવસ્થાઓ.



Have mercy on us ....help us...

